

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૬/૦૭/૨૦૧૮ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૨૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૨ કેસ કરી, ૩૬ વ્યક્તિઓને ઝડપી, ૧૮૩ લીટર દેશી દારૂ, ૧૦૮ બોટલ ઇંગ્લીશ દારૂ, ૨૮ બિયર ટીન અને ૦૧ સ્ફટક કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૪ કેસ કરી ૨૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨,૧૨,૮૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૨૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૦૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૪૨૨/૧૮

વાસણા : ધ્રુવ રાજેશકુમાર કાનાબાર (રહે,ખોડીયારનગર વિભાગ-૨ મદ્રાસીમંદીર ની પાછળ વાસણા) એ તા.૨૫/૭/૧૮ નારોજ વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે તા.૩૦/૦૬/૨૦૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન આરોપી (૧) રાહુલ શર્મા (૨) ઇશા રાય અને (૩) સુઇત ગુપ્તા (જેઓના પુરા નામ-સરનામ ની ખબર નથી તે) ભેગામળી દૈનિક સમાચાર માં નોકરી વિષયક રીલાયંસ જીઓ કંપની ની જાહેરાત આપેલ, જે વાંચી ધ્રુવે વાતચીત કરતા ઘરે બેઠા કમાવવાની લોભામણી વાત કરી, વિશ્વાસમા લઇ સભ્ય બનવા અને અલગ-અલગ ચાર્જ પેટે ધ્રુવ પાસેથી કુલ રૂપિયા ૩,૬૭,૭૫૦/- અલગ-અલગ બેંક ખાતામા જમા કરાવડાવી, તે પૈસા પરત માગતા નહિ આપી ધ્રુવ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા ચલાવે છે.

મણીનગર : દલસુખભાઈ શનાભાઈ પરમાર (ઉ.વ.૩૮)(રહે,ઠાકોરવાસ અમરાઇવાડી) એ તા.૨૫/૭/૧૮ નારોજ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે તા.૨૪/૦૫/૧૮ થી તા.૧૭/૦૬/૧૮ સાંજના ૬/૩૦ દરમિયાન મણીનગર આઇ.સી.આઇ.સી.આઇ.બેંક રામબાગ શાખા ખાતેથી અજાણી વ્યક્તિએ દલસુખભાઈના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન પે.ટી.એમ. તથા ઓલામની દ્વારા કુલ રૂપિયા ૧,૪૮,૦૬૦/- ખાતામાંથી ઉપાડી લઇ, દલસુખભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી પી.જી.સરવૈયા ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૪૨૩/૧૮

નરોડા : જયકુમાર રાજેન્દ્રકુમાર વ્યાસ (રહે, હરીવલ્લભ સોસાયટી, મહાપ્રભુજીની બેઠકની સામે, નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૭/૧૮ ના કલાક ૧૧/૩૦ થી સાંજના ૫/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ખુલ્લા ઘરના ધાબા ના દરવાજા વાટે અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, બેડરૂમના વોર્ડરોબમા મુકેલ રોકડ રૂપિયા ૪૦,૦૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી વી.આર.ચૌધરી ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૧૪૨૪/૧૮

સોલા હાઇકોર્ટ : રમીલાબહેન વિનોદકુમાર પટેલ (ઉ.વ.૪૭)(રહે,સેલેટીયલ લીવીંગ ફ્લેટ, સાયન્સ સીટી રોડ સોલા) તા.૨૫/૭/૧૮ ના કલાક ૧૧/૩૦ વાગ્યાના સુમારે ડીવાઈન પાર્ક રોડ સત્વ સોસાયટી ગેટ પાસે રોડ ઉપર થી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષો (૨૫ થી ૩૦ વર્ષના આશરના) રમીલાબહેન ના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ રમીલાબહેન પટેલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.પરમાર ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ :

સમાચાર યાદી નં.૧૪૨૫/૧૮

“જે” ટ્રાફિક પો.સ્ટે.: ગૌતમભાઈ શાંતિલાલ ગોહેલ (ઉ.વ.૨૭)(રહે.વંદના સોસાયટી, શના નગરની સામે, વટવા ગામ) તા.૨૫/૦૭/૧૮ રાતના ૯/૦૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે જશોદાનગરથી હાથીજણ સર્કલ તરફ જતા રોડ ઉપર અંબીકા વે-બ્રીજ ની સામે રોડ ઉપરથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી લાવતા, એક્ટીવાને ટક્કર વાગતા ગૌતમભાઈ ને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગેની ફરીયાદ મરણ જનાર ગૌતમભાઈના કૌટુંબીક ભાઈ નવદીપભાઈ ગોહેલે “જે” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની પો.ઇ.શ્રી એ.બી.નાગોરી ચલાવે છે.

આત્મહત્યા :

સમાચાર યાદી નં.૧૪૨૬/૧૮

ગોમતીપુર : મયુરભાઈ જીતેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.૨૨)(રહે,મગનકુંભારની જુનીચાલી ધોળકા મીલ સામે ગોમતીપુર) એ કોઇ અગમ્ય કારણસર તા.૨૫/૦૭/૧૮ ના કલાક ૧૨/૪૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતાના ઘરે છતના લાકડાના વડી સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એમ.ચૌધરી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.